



દિવાળી અને ન્યૂ ઈયર્સ ઈવ માટે ફટાકડા વિક્રેતાઓ માટેની ઓનલાઇન તાલીમ ખુલ્લી છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 6, 2020) – સીટી ઓફ બ્રેમ્પટને દિવાળી અને નૂતનવર્ષની પૂર્વ સંધ્યા માટે આ વર્ષે ફટાકડા વેચવાનું આયોજન કરતા વિક્રેતાઓ માટે ઓનલાઇન તાલીમ પ્રક્રિયા ખુલ્લી મૂકી છે.

આ તાલીમ ફરજિયાત લેવાની રહે છે અને વિક્રેતાઓ ફટાકડા વેચવાનું લાઇસન્સ મેળવી શકે તે પહેલાં આ અભ્યાસક્રમ ફરજિયાત છે.

અભ્યાસક્રમ માટે નોંધણી કરાવવા, વિક્રેતાઓ બ્રેમ્પટન ફાયર પ્રિવેન્શનને 905.874.2740 નંબર પર કોલ કરી શકે છે અથવા ઈમેઇલથી fire.prevention@brampton.ca સરનામે સંપર્ક કરી શકે છે અને અભ્યાસક્રમની વિગતો અરજદારને ઈમેઇલથી મોકલવામાં આવશે.

COVID-19 માટે આરોગ્ય અને સુરક્ષા પ્રતિબંધો અમલમાં હોવાને લીધે, ઓનલાઇન તાલીમ પાંચ સરળ પગલાઓમાં આપવામાં આવશે:

1. 2020 ફાયરવર્ક્સ રિટેઇલર કોર્સ માટેની ફી ચૂકવો અને ફાયર ઈન્સ્પેક્શન માટે અરજી કરો
2. ફાયરવર્ક્સ રિટેઇલર તાલીમ વીડિયો જુઓ
3. ફાયરવર્ક્સ રિટેઇલર પ્રશ્નાવલી ભરો
4. લાઇસન્સ અરજી અને નોંધણી ફી જમા કરાવો. વિગતો માટે ઈમેઇલથી licensing@brampton.ca સરનામે સંપર્ક કરો.
5. 2020 ફાયરવર્ક્સ રિટેઇલર લાઇસન્સ રૂબરૂમાં સીટી હોલમાંથી મેળવો. સીટી હોલની મુલાકાત લેતા પહેલાં એપોઇન્ટમેન્ટ ફરજિયાત લેવાની રહે છે.

ફટાકડા વિક્રેતા તાલીમમાં વેચવાની છૂટ અપાતા ફટાકડાના પ્રકારો, સંગ્રહ કરવાને લગતા નિયમો, ફટાકડાનું પ્રદર્શન અને વેચાણ, ગ્રાહક આઈડી જરૂરિયાતો અને ખરીદનારાઓને વિતરણને લગતી સુરક્ષા માર્ગરેખાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.

બહુવિધ સ્થળોએ વેચાણ કરતા વિક્રેતાઓ માટે, અભ્યાસક્રમ પૂરો કરવા દરેક સ્થળે ઓછામાં ઓછાં એક ઓપરેટરની જરૂર પડે છે. વિક્રેતાઓએ એ પણ નોંધવું રહ્યું કે ફાયર ઈન્સ્પેક્શન માટે અરજી કરવાની છેલ્લી તારીખ શુક્રવાર, ઓક્ટોબર 23, 2020 નાં રોજ બપોર સુધીની છે.

સીટી ઓફ બ્રેમ્પટનનો બાય-લો (પેટા-કાનૂન) માત્ર ટૂંકા અંતરના ફટાકડાનું વેચાણ અને અંગત વપરાશ (ફટાકડા સળગાવો ત્યારે 3 મીટર કે 10 ફૂટથી ઓછાં અંતર સુધી ઉડે તેવા ફટાકડા) વર્ષમાં ચાર વખત - વિક્ટોરિયા ડે, કેનેડા ડે, દિવાળી અને નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ કરવાની પરવાનગી આપે છે.

મિડિયા સંપર્ક

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca